


RAN-2308000601030001
F.Y.B.Com. (Sem. - I) Examination November - 2025
Economics - Minor : Business Economics
Time: 2 Hours]
[Total Marks: 50
સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature
પ્ર. 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો (કોઈપણ પાંચ) (10)

1. અર્થતંત્રની મૂળભૂત આર્થિક સમસ્યાઓ કઈ છે?
2. ધંધાકીય અર્થશાસ્ત્રનાં લક્ષણો જણાવો.
3. માંગના નિર્ણાયક પરિબલો જણાવો.
4. માંગ આગાહીની વ્યાખ્યા લખો.
5. પૂરવઠાની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો જણાવો.
6. સીધા ખર્ચ અને આડકતરા ખર્ચ વચ્ચેનો તફાવત આપો.
7. સીમાંત ખર્ચ એટલે શું?

પ્ર. 2. માંગની આવક સાપેક્ષતા એટલે શું? માંગની આવક સાપેક્ષતાનાં પ્રકારો આકૃતિ સહિત સમજાવો. (14)
અથવા
પ્ર. 2. અ. ધંધાકીય અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર સમજાવો. (07)
બ. વટાવનો સિદ્ધાંત સમજાવો. (07)
પ્ર. 3. બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ આકૃતિ સહિત સમજાવો. (14)
અથવા
પ્ર. 3. અ. સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ અને સરેરાશ કુલ ખર્ચના ખ્યાલો આકૃતિ સહિત સમજાવો. (07)
બ. લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખાના લક્ષણોની ચર્ચા કરો. (07)
પ્ર. 4. ટૂંકનોંધ લખો (કોઈપણ બે) (12)

1. વૃદ્ધિનો ખ્યાલ
2. પૂરવઠાનો નિયમ
3. માંગ આગાહીની વલણ પદ્ધતિ
4. સરેરાશ આવક અને સીમાંત આવકનો ખ્યાલ

ENGLISH VERSION

- Q. 1. Answer the following questions in brief: (Any Five) (10)**
1. Which are the basic problems of an economy?
 2. State the characteristics of business economics.
 3. State the determinants of demand.
 4. Write the definition of demand forecasting.
 5. State the types of elasticity of supply.
 6. Give the difference between direct cost and indirect cost.
 7. What is marginal cost?
- Q. 2. What is income elasticity of demand? Explain the types of income elasticity of demand with the help of diagram. (14)**
- OR**
- Q. 2. (A) Explain the scope of business economics. (07)**
(B) Explain the discounting principle. (07)
- Q. 3. Explain-the law of variable proportion with the help of diagram. (14)**
- OR**
- Q. 3. (A) Explain the concepts of average fixed cost, average variable cost and average total cost with the help of diagram. (07)**
(B) Discuss the characteristics of long run average cost curve. (07)
- Q. 4. Write short notes: (Any Two) (12)**
1. Incremental concept
 2. Law of supply
 3. Trend method of demand forecasting
 4. Concept of average revenue and marginal revenue.
-